

B.Ed. Semester - 2 (CBCS) Examination
August/September -2020 [NEW COURSE]
Accountancy Content (GROUP A CONTENT-1)

Time: 1:00 Hours

Marks: 28

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (૦૪)
- (1) વીસરચૂક ભૂલ એટલે શું?
 - (2) સરખા હપતાની અને ઘટતી જતી બાકીની પદ્ધતિના સૂત્રો લખો,
 - (3) ગુપ્ત અનામત એટલે શું?
 - (4) વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાંના કોઈ પણ બે તફાવત સમજાવો.
 - (5) દેશીનામા પદ્ધતિ અનુસાર 'આવરો' એટલે શું?
- પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ૦૪ પ્રશ્નોના જવાબ લખો. (૦૮)
- (1) દેશીનામા પદ્ધતિ અનુસાર 'તારીજ' અને 'ફાંકુ મારવું' સમજાવો.
 - (2) કમ્પ્યુટર હિસાબી પદ્ધતિની ચાર મર્યાદાઓ સમજાવો.
 - (3) કાચા સરવૈયામાં અસર ન કરતી બે ભૂલોના ઉદાહરણ લખો.
 - (4) એક યંત્ર તા. ૧.૦૪.૨૦૧૫ના રોજ ખરીદવામાં આવ્યું હતું. તા. ૦૧.૦૪.૨૦૧૮ના રોજ યંત્ર ખાતાની શરૂની બાકી ₹ ૩૨,૦૦૦ છે. યંત્ર પર ૧૨ ટકા લેખે સરખા હપતાની પદ્ધતિએ ઘસારો ગણાય છે. તા. ૩૧.૦૩.૨૦૨૦ના રોજ ઘસારાની આમનોંધ લખો.
 - (5) સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેના તફાવતના બે મુદ્દા જણાવો.
 - (6) નફાના પ્રકારોની ટૂંકમાં સમજ આપો.
- પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ૦૪ પ્રશ્નોના જવાબ લખો. (૧૬)
- (1) કાચાં સરવૈયું અને પાકાં સરવૈયાનો તફાવત લખો.
 - (2) નીચેના વ્યવહારો માટે હવાલા નોંધ લખો અને તેની વાર્ષિક હિસાબોમાં અસરો દર્શાવો.
 ૧. પગાર અને ભાડુંના અનુક્રમે ₹ ૫૦૦૦ અને ₹ ૧૨૦૦ ચુકવવાના બાકી છે.
 ૨. ₹ ૩૨૦૦ દલાલીના એડવાન્સ મળ્યા છે.
 ૩. ₹ ૩૦૦૦નું ખરીદ પરત ભૂલથી ઉધાર વેચાણ તરીકે નોંધેલ છે.
 ૪. ₹ ૧૦૦૦યંત્ર ગોઠવવાની મજૂરી ભૂલથી મજૂરી ખાતે ઉધારી છે.
 ૫. ₹ ૮૦૦૦નો માલ આગમાં બળી ગયો. વીમા કંપનીએ ₹ ૬૫૦૦નો દાવો મંજૂર કર્યો છે.
 - (3) નાણાકીય પત્રકોનું મહત્વ સ્પષ્ટ કરો.
 - (4) મૂડી અનામતનો અર્થ, પ્રાપ્તિસ્થાન અને તેના ઉપયોગ સમજાવો.
 - (5) ભારત લિમિટેડના ચોપડામાં તા. ૦૧.૦૪.૨૦૧૭ના રોજ યંત્ર ખાતાની બાકી ₹ ૧૪૦૦૦૦ છે. કંપની દર વર્ષે ૫ ટકા લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે, તા. ૩૦.૦૬.૨૦૧૭ ના રોજ આ યંત્ર તેની ચોપડેકિંમત પર ૩૦ ટકા નુકસાનથી વેચી દીધું. ઉપરની વિગતોના આધારે કંપનીના ચોપડે જરૂરી આમનોંધ તથા યંત્ર ખાતું તૈયાર કરો.
 - (6) સિદ્ધાંતની ભૂલ ઉદાહરણ સહિત સમજાવો.

English Version

Que-1 **Answer any four questions from the following** (04)

1. What is error of omission?
2. Write down the formula of Straight line method and reducing balance method.
3. What is hidden reserve?
4. Explain the two differences between trading account and profit and loss account.
5. What is 'Aavro' as per Deshi Nama system?

Que-2 **Answer any four questions from the following** (08)

1. Explain the *Tarij* (Summary) and '*Fanku Maravu*' as per Deshi Nama Method.
2. Explain any four limitations of computer Accounting.
3. Write down two examples of the errors that do not affect the trial balance.
4. Clarify with illustration the relation between specific objective and expected behavioral change.
5. Give two points of difference between General reserve and provisions.
6. Explain in brief about types of profit.

Que-3 **Answer any four questions from the following** (16)

1. Write down the difference between trail balance sheet and balance sheet.
2. Pass the journal entry and its effect in final accounts.
 1. ₹ 5000 for salary and ₹ 1200 rent is pending for payment.
 2. ₹ 3200 received advance for brokerage.
 3. Return of goods ₹ 3000 is accounted as credit sales by mistake.
 4. ₹ 1000 installation charge for machine is debited as labor charge.
 5. Goods of ₹ 8000 are burnt out in fire. The insurance company has sanctioned claim for ₹ 6500.
3. Clarify the importance of Financial Statements.
4. Explain the meaning, sources and uses of capital reserve.
5. Opening balance of Machine account is ₹ 140000 in the books of Bharat Ltd. As on 01/04/2017. The Company is calculating 5 % of depreciation as reducing balance method. The company has sold out the machine on Dt. 30/09/2017 at 30% loss on it Book value of the same. Prepare necessary journals and machine account in the book of company.
6. Explain the error of principle with illustration.
